

B.A. Semester - 2 (CBCS) Examination

March/April- 2019 (Old Course)

ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2
(ELECTIVE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનાં ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.
- પ્રશ્ન-૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો.
- પ્રશ્ન-૩ ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત સમજાવો અને તેની ટીકાઓ જણાવો.
- પ્રશ્ન-૪ “નફો નવપ્રવર્તનનું પરિણામ છે” – ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ ઉદ્યોગ વિકાસનાં લાભોની ચર્ચા કરો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
(૧) પેઢી વિકાસનાં લાભો.
(૨) આભાસી ભાડું.
(૩) ઘટતા મળતરનાં નિયમની ઉપયોગિતા.
(૪) સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ.

ENGLISH VERSION

- Que-1 Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure. (14)
OR
- Que-1 Clarify the interrelationships between Average cost and marginal cost with the help by diagram.
- Que-2 Explain the law of Diminishing returns. (14)
OR
- Que-2 Explain the concept of opportunity cost with the help of illustration.
- Que-3 Explain the modern theory of rent. (14)
OR
- Que-3 Explain the dynamic theory of profit and criticize it.
- Que-4 “Profit is a result of innovation” – Discuss. (14)
OR
- Que-4 Discuss the advantages of expansions size of Industry.
- Que-5 Write short notes. (any two) (14)
(1) The advantages of expansions size of firm.
(2) Quasi-Rent.
(3) Usefulness of law of diminishing return.
(4) Fixed cost and variable cost.
